

Internal Examination October : 2016

DATE : 1-10-2016

B. Com. Semester - I

TIME : 12.30 to 2.30

Saturday

Tally Accounting (F.C.)

Marks : 100

- Q. 1 “ટેલી સોફ્ટવેર પદ્ધતિ” પર ટૂંકનોંધ લખો. 20
- Q. 2 ટેલીના 7.2 ના સ્વરૂપ હેઠળ મૂળ સ્થાનેથી કરકપાતના તબક્કાઓ સમજાવો. 20
- Q. 3 હિસાબોમાં કમ્પ્યુટરની ઉપયોગિતા અને મર્યાદાઓ જણાવો. 20
- Q. 4 ટેલી સોફ્ટવેર 7.2 માં ખરીદીના વ્યવહારો અને વેચાણના વ્યવહારોની નોંધ કેવી રીતે થાય છે તે વિગતવાર સમજાવો. 20
- Q. 5 ટૂંકમાં જવાબ આપો : 20
- (i) F2 કી (Key) નું કાર્ય શું છે ?
- (ii) F7 કી (Key) નું કાર્ય શું છે ?
- (iii) જો ટેલીમાં પાકા સરવૈયું અને નફા-નુકસાન ખાતાની વિગતવાર માહિતી મેળવવી હોય તો કઈ કી (Key) દબાવવી પડશે ?
- (iv) ટેલીના હિસાબોમાં જો રોકડની ચુકવણીની આમનોંધ કરવી હોય તો કઈ કી (Key) દબાવવાની રહેશે ?
- (v) જમાખર્ચી વ્યવહાર એટલે શું ?
- (vi) કમ્પ્યુટરની ઝડપ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે ?
- (vii) ઈનપુટ (નિદેશ) માટે વપરાતાં બે સાધનોનાં નામ લખો.
- (viii) માઈક્રોસોફ્ટ એક્સેલ શું છે ?
- (ix) ભારતમાં ઉપયોગમાં લેવાતાં કોઈ પણ ત્રણ એકાઉન્ટિંગ સોફ્ટવેરના નામ આપો.
- (x) ટેલી દ્વારા વિકસિત છેલ્લું એકાઉન્ટિંગ સોફ્ટવેરનું નામ આપો.

- Q. 1 Write note on "Tally Software System." 20
- Q. 2 Under 7.2 Tally version explain steps for Tax deducted at source. 20
- Q. 3 Give the Usefulness and limitation of Computer Accounting. 20
- Q. 4 Under Tally Software 7.2 version, how are purchase transactions and sales transactions recorded, Explain in details. 20
- Q. 5 Answer in Brief : 20
- (i) What is the function of F2 Key ?
 - (ii) What is the function of F7 Key ?
 - (iii) Which key is pressed to see details of Balance-sheet and P & L A/c. in Tally ?
 - (iv) Which key must be pressed for entry of cash payment is to be made in Tally ?
 - (v) What is Contra Transaction ?
 - (vi) What is the unit of measuring the speed of Computer ?
 - (vii) Mention any two input devices.
 - (viii) What is Microsoft Excel ?
 - (ix) Give three name of popular Accounting Software in India.
 - (x) Give the name of latest Accounting Software developed by Tally.

* * * * *